



હાલાઈ મુસ્લિમ ખત્રી ટ્રસ્ટ મુખપત્ર

ટાઈમ્સ ઓફ ખત્રી

Times of Khatri

માસિક

હાલાઈ મુસ્લિમ ખત્રી સમાજની સેવાર્થે • આ માસિક પત્રિકાને રાજક્રારી બાબતો સાથે કશો જ સંબંધ નથી. ફક્ત સમાજિક સેવાનો ધ્યેય છે.

વર્ષ-૮ અંક-૩ સળંગ અંક-૮૩
તંત્રી : સ્વીક અબુબકર છાટબાર

માહે-શાબાન
For abroad: £ 10

હિજરી-૧૪૪૫
વાર્ષિક લવાજમ રૂ. ૧૨૦/-

માર્ચ-૨૦૨૪

કડવી વાસ્તવિકતાઓ

► મોહમદ હુસેન એ. ઘડા, પોરબંદર

લખાય જાય છે જે લખવું હોય, વંચાય જાય છે જે વાંચવું હોય, પરંતુ સમજાવું એ જ નથી જે સમજવાનું હોય. અનેક લેખકો, કવિઓ, તત્ત્વચિંતકો જીવનમૂલ્યો પોતાની શૈલીમાંલખી ગયા અને નવલોહિયા લેખકો હજુ પણ લખે છે. પરંતુ કોઈનો એ બધું લખવા પાછળનો ઉદ્દેશય નોંધપાત્ર સાર્થક થઈ શક્યો નહિ.

આપણે તો બીજા કોઈને જોવાની જરૂર જ નથી, માત્ર આપણી હાલાઈ મુસ્લિમ ખત્રી બિરાદરીમાં જ નજર દોડાવીએ તો આ પ્રગતિની અને ઈલ્મની વાતો બધી પોકળ જ વર્તાય. આપણને એવો વહેમ છે કે આપણે ખૂબ જ શિક્ષિત અને ઈલ્મે દિનના જાણકાર છીએ. હકીકતનું ઊંડાણપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરો તો મોટા મોટા શહેરોમાં વસતા પરિવારો હજુ પણ એ જ જીહાલતમાં જીવે છે. અરે, હું તો એમ કહીશ કે જૂના જમાના કરતા પણ બદલતર જીહાલતના શિકાર થઈ ચૂક્યા છે. જુનવાણી માણસો કદાચ ઓછું ભણેલા હતા, પરંતુ તેમની એક એક ભલામણ આજે ઉચ્ચ શિક્ષિત પણ ન આપી શકે એવી હતી. આ નિવેદન ઘણાંને નહીં સમજાય અને ઘણાં સમજી જશે પરંતુ, પોતાની જીહાલતનું પ્રદર્શન ન થઈ જાય એટલા માટે ન સમજવાનો ઢોંગ કરશે. ચાલો વાસ્તવિકતાના ઢ્વાર ખખડાવીએ.

વાસ્તવિકતા નં. ૧

ન કરવાના કામ કરવા અને પછી ખુદાની રહેમત ચાહવી.

આજના યુગમાં વાતો બધા ઈમાનની કરે છે, પરંતુ તક મળ્યે બેઈમાનીનો લાભ ઉઠાવવાનું કોઈ ચૂકતા નથી. સમય બેરંગી જીવન જીવવાનો બની ચૂક્યો છે. દુનિયા સામે રંગ જુદો અને બંધ બારણે રંગ જુદો. શોધવા નિકળો તો જૂજ એવા ઈન્સાન મળે જે સાચા અર્થમાં ઈમાન ઉપર મુસલ્મ હોય. બાકી બધા પ્રલોભન સામે ખૌફે ખુદા લેશ પણ યાદ કર્યા વગર લાભ ઉઠાવી લેનારા જ મળશે. દુનિયા સમક્ષ તો સુન્ની હોય, મોટા હાકલા પડકાર કરતો જોવા મળે, અને પાછલા બારણે વહાબી અને જમાઅતી સાથે વ્યાપારમાં ભાગીદાર પણ હોય એવા અનેક દાખલાઓ મળશે. આ બેરંગી અને ઢોંગી જીવનથી ખુદા નારાજ થાય છે. અકાળે નુકશાન આવે છે, બરકત ઉઠી જાય

છે. ત્યારે મકબૂલ સમયે હાથ ઉઠાવીને અને દુઆઓ કરે છે.

વાસ્તવિકતા નં. ૨

દીકરીને ઉથમી નસિહતો આપવી.

દીકરી નસીબદારને ત્યાં જન્મે છે. જે ઘરે દીકરી નથી હોતી ત્યાં ગમે તેટલું સુખ હોય પરંતુ કંઈક ખૂટતું લાગે છે. દીકરી માં બાપને ખૂબ જ વ્હાલી હોય છે. પરંતુ દીકરીને પરણાવ્યા પછી માં બાપના વ્હાલ ક્યારેક દીકરીના ઘરને બરબાદ કરનારા બની જતા હોય છે. દરેક દીકરી પોતાના માં બાપની લાડકી જ હોય. પરંતુ એ લાડ તેને પરણાવ્યા પછી થાબલભાણા બની જતા હોય છે. લગ્નપછી જો માં બાપ દીકરીને છાશવારે પોતાના ઘરે બોલાવ્યે રાખતા હોય, માં બાપથી અલગ થવા માટેના દાવપેચ શીખવાડતા હોય, પતિ, સાસુ, સસરાની સામે તડાતડ જવાબ આપતાં શીખવાડતા હોય અને જો એમ સમજતા હોય કે તેમને દીકરી બહુ વ્હાલી છે એટલે તેની હિંમત વધારે છે તો એ માં-બાપથી મોટા જાહિલ બીજા કોઈ નથી. દીકરીને સારી સમજ, ઘર ચલાવવાની કેળવણી, સહનશીલતા અને આદરના ગુણો આપવાની જગ્યા એ પોતાના પતિ સામે દીકરીને લડતાં જોઈ અને માં બાપ તેની પીઠ થાબડતા હોય તે કદાચ એ ભૂલી જતા હોય છે કે વારા પછી વારો આવે જ છે. પોતાના દીકરાની વહુને જ્યારે એ જ બધું એમની સાથે કરતાં જુએ ત્યારે દીકરીને ખોટી શિક્ષા આપવાનો અફસોસ થાય છે અને પછી અદાહ સમક્ષ દુઆઓ કરવા લાગે છે.


વાસ્તવિકતા નં. ૩

સમાજની અવગણના.

જમાત એ બેશક સામાજિક માળખું છે, જમાત વગર કોઈ મરી નથી જવાનું, પરંતુ જમાતથી વ્યક્તિ અને પરિવારની શાખ છે. જમાત સાથે રહેવાથી કોઈ ગાડી બંગલા નથી બની જવાના, અને ન રહેવાથી કશું લૂંટાઈ નથી જવાનું. પરંતુ એક સામાજિક વ્યવસ્થા પરિવારને અને તેની આવનારી પેઢીને એક આગવી ઓળખ પ્રદાન કરે છે. દરેક જમાતની પોતપોતાની એક સંસ્કૃતિ હોય છે. જેના પરિણામ સ્વરૂપ દેશ વિદેશમાં એક સાંસ્કૃતિક અને વૈચારિક આદાન પ્રદાન થાય છે. “અસા કે

અનુસંધાન પાના નં. ૩ ઉપર

+91 9820223138



Fauz EXPORTS
Manufacturer - Exporter - Importer
(Serving Our Valued Customers Since 1994)

(Government Recognised Two Star Export House)

Asif Khatri
Managing Director

179, Commercial Chambers,
5th Floor, Office No. 70, Yusuf Meher Ali Road,
Opp. Zakaria Masjid, Mumbai - 400 003. (INDIA)
☎ +91 22 2345 5378 / 2345 5479
✉ : fauzexports@gmail.com
🌐 : www.fauzexports.com

ટેન્શન અને સુકૂન

રજૂઆત: અ.ગદાર એમ. સોનેજી “નૂરી”, દુબઈ

વર્તમાન યુગમાં દરેક ઇન્શાન ટેન્શન (તાણ) સાથે જીવન વિતાવી રહ્યો છે, તેમ કહીએ તો તે સદંતર ખોટું પણ નથી. કોઈને ધંધા રોજગારનું ટેન્શન તો કોઈને જાતની તંદુરસ્તીનું ટેન્શન, કોઈને પોતાની ઔલાદનું ટેન્શન તો કોઈને સંબંધો કેમ જાળવી રાખવા તેનું ટેન્શન. જેને પૂછો તેને કોઈના કોઈ ટેન્શન તો હશે જ. “તારે કોઈ જ ટેન્શન નથી તેનું છે ટેન્શન!!!” અદ્યાહના ઘણાં નેક બંદાઓ ટેન્શન ફી લાઈફ જીવતા જોવા મળે છે પણ ખરા !!

કોઈ ફરીયાદ કરતો જોવા મળશે કે આ મોંઘવારીએ તો બે છેડા ભેગા કેમ કરવા તેનું ટેન્શન ! બે બાળકોને ભણાવવા જે ખર્ચ થાય છે તેનું ટેન્શન! ઘરવાળી સારી મળી હોય તો ઠીક, બાકી બે ત્રણ મહિને કામવાળીનું ટેન્શન તો ઉભું હોય જ!

તમને એમ કે દોલત જેથી પાસે છે તેને વળી શું ટેન્શન? અરે ભાઈ, ઇ જયારે આવે છે ને ત્યારે એક લાત આગળ મારે છે તો ઇન્શાન અકડ થઈ જાય છે અને જયારે એ જાય છે ત્યારે બીજી લાત મારે છે ત્યારે ઇન્શાન બેવડ થઈ જાય છે. ટટ્ટાર ચાલવાનું જ ભૂલી જાય એટલે જ “દો લત” કહે છે. આમ તે આવે તોય ટેન્શન અને જાય ત્યારે પણ ટેન્શન!!! પૈસાથી સુકૂન ખરીદી શકાતું હોત તો બજારમાં સુકૂન લેવામાં લાંબી કતારો લાગી જાત. ટેન્શન દૂર કરવા લોકો સુકૂનની શોધમાં નીકળે તો છે, સુકૂન શોધવા તે શરાબ, જુગાર, સંગીત, વ્યસનના રવાડે ચડી જાય છે. ક્ષણ પુરતો સુકૂન હાસિલ થવાનો એહસાસ જરૂર થાય છે. પણ લાંબે ગાળે તે વધુ ટેન્શન ક્રિએટ કરે છે અને બદલામાં તે એક નવા ટેન્શનના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે.

ટેન્શનને દૂર કરવા સુકૂન હોવું જરૂરી છે, સુકૂન વિશે જાણીએ. સુકૂનની વ્યાખ્યા કરવી હોય તો તે નીચે પ્રમાણે કરી શકાય.

“સામાન્ય રીતે મનુષ્ય સુકૂન શોધવા ઉપર બતાવ્યા પ્રમાણે સંગીત-નશામાં એ સુકૂન શોધવા પ્રયત્ન કરે છે. પરંતુ ખરેખર આ બધા કૃત્યો પછી તેને નિરાશા જ હાથ લાગે છે. ગુનાહના કૃત્યોમાંથી કદી સુકૂન હાસિલ થઈ જ ના શકે, તેને તથા તેના કુટુંબને બેશર્મા કે નફરતના વંટોળમાં ઘેરાઈ જવાથી ગૃહશાંતિને અસર થાય છે. આ નફરત ભરેલી વ્યસનોની આદતથી સમાજનો દરેક વર્ગ નફરતની નિગાહથી જુએ છે. તો તેમાં સુકૂન ક્યાંથી મળે? ટેન્શન ક્યાંથી ઘટે?”

સુકૂન કે સંતોષ એ એવી હકિકત છે જે એવી કેફીયત છે જે ઇન્શાનને ખુશીના સમયે કે ગમના સમયે એટલો પ્રભાવિત ના કરે તે તેના અખ્લાક અને કિરદાર અને જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર અસર પૈદા ન થવા દે, પછી તે સારી હોય ત્યા ખરાબ. ટૂંકમાં એમ કહી શકાય કે દુઃખ આવી પડે તો વિચલિત ન થાય, પોતાની જાતને દુઃખમાં પણ અડગ રાખે. મંજૂરે ઇલાહી સમજી સબ્રથી કામ લે અને ખુશાલીભર્યા વાતાવરણમાં પણ હદો, પાબંદીઓને ભૂલાવી ન દે. ગમ કે ખુશાલીના પ્રસંગોએ તેને ડગમગાવી ના શકે. સુખની પળોમાં ખુદાને યાદ અને તકલીફમાં ખૌફે ખુદા-શુકાના હંમેશા દિલમાં વસાવી રાખે, એ જ દિલની સાચા સુકૂનની નિશાની છે.

હરોજ અદ્યાહની નેઅમતોનો શુક્રિયા અદા કરતા રહો. નેઅમતમાં ફક્ત બંગલા, ગાડી, સુંદર લાડી, કપડાંલત્તા જ નથી પણ ઈલ્મ, અક્લ, નેક ઔલાદ, ચેહરા પરની મુશ્કરાહટ, અદબ, નેક અખ્લાક, તંદુરસ્તીનો પણ તેમાં સમાવેશ થાય છે.

દિલી સુકૂન જેની પાસે છે તે કદી કોઈ સારા-ખરાબ પ્રસંગે હિમ્મત નહીં હારે જે પણ કાંઈ થાય છે તે સારા માટે થાય છે. અદ્યાહ તઆલા પાસે દુઆ કરતી રહેવી કે મારો અડગ વિશ્વાસ તારા પર છે, તું જ તારણહાર છે. આવા ઇન્શાન કદી ટેન્શનમાં આવશે નહિ.

ટેન્શન આવવાના બે મુખ્ય કારણો છે. એક તો ગમ તથા બીજું કારણ ખૌફ. આ બે કારણોથી દિલી સુકૂન છીનવાઈ જાય છે. કુર્આન (ભાવાર્થ) “અદ્યાહ અમારો રબ છે અને તેના ઉપર અડગતા દાખવી તેમને કોઈ ગમ તથા ખૌફ થશે નહીં.” આના પરથી સાબિત થયું કે ગમ કે ખૌફ ન થાય તો ટેન્શન પણ ના જ આવે. ટેન્શન (તાણ)ને દૂર કરવા કુર્આન વાણી મનુષ્યને જણાવે છે કે “અલા બે ઝિકરીલાહિ તત મેરૂલ કોલુબ” અર્થાત: અદ્યાહની ઇબાદતમાં દિલનું સુકૂન છે, જે કોઈ ઇન્શાન અદ્યાહની ઇબાદતમાં લાગેલો હોય તેના દિલમાં સુકૂનનું સ્થાન પ્રાપ્ત થાય છે. સુકૂન હોય ત્યાંથી ટેન્શન દૂર થઈ જાય છે. સુબ્હાનદ્યાહ! અદ્યાહના વલીઓ (દોસ્તો)ને ના કોઈ ખૌફ હોય છે ના કોઈ ડર. તેઓ હંમેશા ટેન્શન મુક્ત હોય છે. ગમથી મુરાદ ભૂતકાળની નિરાશા, નિષ્ફળતા અને દુઃખનો ભંડાર હોય છે. જયારે ખૌફનો સંબંધ ભવિષ્ય માટે હોય છે. આપું કાંઈક થઈ જશે, ક્યાંક આવો અકસ્માત ન થઈ જાય, કોઈ દુર્ઘટના ના બની જાય વિગેરે વિગેરે. જો આ બન્ને ચીજોથી મુક્તિ મળી જાય

Dr. Aziz Khatri - Mob. 093224 03733

Mohshin Khatri - Mob. 098674 66346



KHATRI DIAGNOSTIC CENTRE

MUMBAI

FACILITIES OFFERED:

Digital X-Ray, Pathology, Sonography, E.C.G., Color Doppler, E.E.G., Stress Test, 2D Echo, C.T. Scan, MRI, P.F.T., APG

Mohammed Husain Girach
Mob. 96621 95028

Abulhasan Girach
Mob. 90995 59155

EMPIRE CREATION

Mfg. or Exclusive Dress Materials & Bandhani

Wholesaler and Retailers

Main Road, Navagadh (Jetpur)



તો સુકૂન છીનવાઈ જવાનો ભય નથી રહેતો. ટૂંકમાં ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ભૂલી જઈ તેના ઉપર અફસોસ કરવાનું છોડી દઈએ અને ભવિષ્યમાં થનારી બાબતો અંગે ગભરાવવાની કે દુઃખી થવાના બદલે ખુદા પર ભરોસો રાખનાર ઈશ્વાન ગમ તથા ખૌફથી છૂટકારો મેળવે છે. જે પણ થયું છે તે સારા માટે થયું છે અને જે પણ કાંઈ થશે તે સારામાટે જ થશે, આવા મક્કમ ઈમાન ધરાવનાર પાસે કદી ટેન્શન આવશે નહિ.

પરંતુ આ એટલું આસાન તો નથી. મનુષ્ય એહસાસો અને ભાવનાઓનું પૂતળું છે. થોડી સરખી પણ વાતથી તે તરતજ વિચલિત થઈ જાય છે. આનો અર્થ એ પણ થાય છે કે ડર અને ખૌફથી પ્રભાવિત થવું કુદરતી છે. પરંતુ ઈબાદતગુઝાર ઈશ્વાન ડર અને ખૌફની પ્રબળ અસર તેના જીવન-વર્તન પર પડવા દેતો નથી તે ગમમાં સુકાઈને સુકલકડી નથી થતો અને હર્ષમાં ફૂલાઈને ફાળકો પણ નથી થતો. તેને અદાહ પર ચકીન હોય છે. તેની રચામાં રાજી રહેતા તેને આવડી જાય છે. તેનું દિલ ગવાહી દે છે કે “ગભરાઈશ નહીં, જે કાંઈ થાય છે તે અદાહના હુકમથી થાય છે, અદાહ બહુ જ મહેરબાન છે, તેના દરેક કાર્યમાં કોઈના કોઈ હિકમત છૂપાયેલી છે. જે મનુષ્યને સમજમાં આવે કે ના આવે પણ તેમાં જ બહેતરી છે. અદાહનો શુક અદા કરો. હરવકત અને જે કોઈપણ પરિસ્થિતિ હોય તેના પર સબ્ર કરો. ટેન્શન મુક્ત જીવન જીવવાની આ અમૂલ્ય જડીબુઝી છે.” કુર્આનમાં (ભાવાર્થ) છે કે “મારા થોડાક જ બંદા શુકગુઝાર છે” આ થોડાંક જ બંદાના લિસ્ટમાં જો આપણું નામ આવી જાય તો

દરેક સમસ્યાનું સમાધાન થઈ જાય. આ થોડાક બંદામાં આપણું નામ સામિલ કરવા પંજગાના નમાઝી બનવું જરૂરી છે. રોઝાનો મહીનો આવી રહ્યો છે. બા બરકત મહીનાની અમૂલ્ય અને બા બરકતવાળી હરએક ક્ષણનો સદ્ઉપયોગ કરીને “આ થોડા”માં સામિલ થઈ જઈએ તો ધ્યેય પ્રાપ્તિથી મુખ પર મુશ્કાન આવી જાય તો તે સુકૂનનું તૃષ્ટિ બિંદુ છે.

આ “થોડા લોકો”ના સમૂહમાં દાખિલ થઈ ડર અને ખૌફના વાતાવરણમાંથી બહાર નીકળી જઈએ તો જીવનમાં સુકૂન હી સુકૂન થઈ જાય. સૌની ભલાઈ માટે ચિંતાગ્રસ્ત રહેવું, હિદાયત માટે કોશિષ કરવી, એજ નબવી મિશન છે. તમારું જીવન પ્રવૃત્તિમય રાખો. રમત-ગમત-મોજ મજામાં સુકૂન નથી. બહુધા લોકો મનની શાંતિ શોધવા દુન્યવી સાજોસામાનની તડપમાં લાગી જિંદગીને બરબાદી તરફ ધકેલી રહ્યા છે. માટે યાદ રાખો અદાહની ઈબાદતમાં લાગેલા રહેશો તો તમારું દિલ સંતુષ્ટ રહેશે. તમને સુકૂન હાંસિલ થશે. નમાઝ ઉપરાંત તિલાવતે કુર્આન પણ અદાહનું ઝિક્ર છે. દરૂદો સલામ પણ અદાહનો ઝિક્ર છે.

ટૂંકમાં, સારાંશ એ જ છે કે અદાહ તઆલાનું ઝિક્ર અને તેના પ્યારા હબીબ સદ્દાહુ અલયહે વસદમની ઈતાઅત કરવી એ સુકૂન હાંસિલ કરવાનો બહેતરીન ઝરિયો છે, ટેન્શન દૂર કરવાનું. અદાહ તઆલા પાસે દુઆ છે કે આપણને સૌને આ વાતો પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે, આમીન. સૌને રમઝાન મુબારક.

અનુસંધાન પાના નં. ૧નું ચાલુ...

જમાત જી કોઈ જરૂર નાય” એવું કહેતાં લેખકે પ્રત્યક્ષ લોકોને સાંભળ્યા છે. એવું કહેનારા જ જ્યારે કોઈ મુસીબતમાં ફસાય છે ત્યારે એ જ જમાત યાદ આવે છે અને એ જ જમાત સમક્ષ મદદની ગુહાર લગાવે છે.

વાસ્તવિકતા નં. ૪

શિક્ષણની અગણના અને સંતાનની સામે બેફામ અપશબ્દો બોલવા અને આબાદ જૂઠ બોલવા પ્રેરવા.

લેખકની કોઈપણ રજૂઆત સાથે અસહમતીનો દાવો આવનારા અંકમાં રજૂ કરી શકાશે. સામાજિક કાર્ય અર્થે ગુજરાતના વિવિધ શહેરોમાં વસતા ઠા. નુ. ખત્રી પરિવારો સાથે રૂબરૂ મુલાકાત, વાર્તાલાપ અને નિરીક્ષણના અંતે લેખકે આ વાસ્તવિકતા અહીં ટાંકી છે. પોતાના દીકરા દીકરી સમક્ષ જ્યારે માં બાપ પોતે જ અભદ્ર ભાષા અને અપશબ્દોનો પ્રયોગ નિઃસંકોચ કરતા હોય તો પછી ઓલાદ પાસે સાડું બોલવાની

આશા કઈ રીતે રાખી શકાય. ઓલાદ એ જ શીખવાની છે જે નાનપણથી પોતાના માબાપને કરતા જોશે. એવા અનેક પરિવારો જોયા છે જ્યાં ઓલાદ કયા ધોરણમાં અભ્યાસ કરે છે એ બાપને ખબર નથી હોતી. બાપ દીકરો એકબીજા સાથે વાતો કરતી વેળાએ કોઈ કારણ વગર વાતમાં ગાળો બોલતા હોય છે અને તેઓ એમ સમજતા હોય છે કે તેઓ પોતાની ઓલાદ સાથે ફેન્ડલી રહે છે. હકીકતમાં એવા માબાપ થી મોટા જાહિલ બીજા કોઈ ન કહી શકાય.

આવા અનેક મુદ્દાઓ છે, જેમ કે શિક્ષણની મહત્તાને અવગણવી અને સંતાનની સામે પોતે અલ્પ શિક્ષિત હોવા છતાં કયા કયા બહાદુરીના કામ કર્યા છે એના વર્ણન કરી સંતાનના દિલો દિમાગમાં શિક્ષણની ઉપેક્ષા જન્માવવી, વ્યક્તિની નિયત અને ચરિત્રને પરખ્યા વગર કોઈને ઘરે બોલાવવા અને પરિવાર સાથે મજાક મસ્તી કરવા વગેરે જે આપણને હજુ પણ પછાત બનાવે છે.



Dr. Aqsa Khatri
M.S. (Gynec), FMAS
RCOG Trainee, London UK



Kutch Women's Hospital

Complete Obstetric & Gynec Care

1st Floor, Paras Apartment, Plot No. 72,
Vijay Nagar, Hospital Road, BHUJ-Kutch

☎ 02832-296396 📞 95865 15690

follow us:
f dr.aqsa4439
📷 gynec_doctor_aqsa

24 Hrs. Emergency Facility Available

Ahmed Raza ☎ +971 6 5350313 📞 +971 55 5983786 www.maplestar.ae Muhammed Akib ☎ +971 4 359 3987 📞 +971 58 849 4679



مبیل ستار للکمپیوٹر ش.ذ.م.م.
MAPLESTAR COMPUTERS L.L.C.

Dubai : Shop No.10, Next to Gateway Hotel, Bur Dubai (UAE) • Sharjah : Shop No.9 &10, Industrial Area No.6, Sharjah (UAE)

IMPORT • EXPORT • BUY • SELL • REPAIRS • SPARES • LAPTOPS • DESKTOPS • MONITORS • AIO • RAM • HDD • SSD

નિયમિતતાનું જીવનમાં મહત્વ

➤ રજૂઆત: નશરીન જુનેદ ખાત્રી, ભૂજ

માનવી જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયગાળા દરમિયાન કશુંક કરવા માટે પૃથ્વી ઉપર આવ્યો છે. છતાં પણ એ સિદ્ધ કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવામાં ઘણી વખત નિષ્ફળ રહેતો હોય છે. એક મહત્વનું કારણ છે, પોતાની જાતમાં રહેલો ક્યાંક અવિશ્વાસ! અને બીજું મહત્વનું કારણ છે “પછી કરી લઈશ એવો અંતરાત્માનો ઉદ્ગાર!!”

આપણે પોતાના જીવનમાં નિયમિતતા ટાળીએ છીએ. જેને લીધે સમયાંતરે ઘણું બધું ગૂમાવવું પડે છે. સૌથી મોટી ખામી આપણા ઘરોમાં પ્રવર્તે છે. “ચાલશે” બધું ચલાવી લઈને આપણે ક્યાંક ઘણું બધું જતું કરી દેતા હોઈએ છીએ. “punctuality leads to successful life”

આપણી પાસે સરસ મજાના બે હાથ છે, મગજ છે, પગ છે તો પછી આળશમાં, વાતોમાં આપણી જવાની શા માટે

આપણે પોતાના પગ ઉપર કુહાડી મારીએ છીએ?? આપણે સૌને એ ખબર જ છે કે આ જનારો સમય ફરી આવવાનો નથી અને જીવન દરમિયાન કરેલું લેખે લાગે જ છે, મારો સ્વઅનુભવ છે. શોખ ખાતર કરેલા કામો પણ તમારી કારકિર્દીમાં ખૂબ ઉંચા સ્તરે તમને લઈ જાય છે. કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે કંઈક ને કંઈક જીવનમાં કરતા રહો, અદાહ પાક તમને કંઈકને કંઈક તો આપશે જ!!

જીવનમાં એક સિદ્ધાંત પાડી લ્યો. “આટલા વાગે આ કામ મારાથી થઈ જ જવું જોઈએ.” અને એક ઢ્રઢ આત્મવિશ્વાસ સાથે જીવનમાં કંઈક કરવા માટે પગલું ભરો. કોઈપણ કાર્ય કરવા માટે ઢ્રઢ મનોબળ, આત્મવિશ્વાસ અને સમયની પાબંદી ખાસ જરૂરી છે. તમારી મહેનત એળે નહીં જાય, સર્જનહાર તમારી સાથે જ છે. and you can do it!!

"Kullu Nafsin Zayakatul Maut"

➤ Fayaz Girach

That was a dusky Friday morning, I received a call from him, A firm, enthusiastic & lil fast speaking gentle voice in my ears. "Fayaz, Jumma ji namaz aav pugi vinno si..Jama'at jo time kuro ay Rajkot mei?" That's how he was, always worried about Salah, A man of Obedience & discipline towards Salah, strictly following Islamic principles of Ahle Sunnah, Amin Wadape. I have seen many guests asking for various things on arrival. Some asked for tea, for breakfast/lunch, a few wanted to get refreshed, a few inquired about future travels, timing etc. but he always asked "Namaz jo time aay?" And he quickly made wuzu & offered Salah.

The news rattled me, shocked me, disturbed me, broke me a little from inside, I couldn't believe it.. I was silent deep, as if he was around me, just a month ago i met him when he visited Gujarat, It seems just another random day, getting up early, praying Fazr, well-dressed after a shower, oiled n combed hairs, with a blend of itr flowing in air.. I can still feel his essence, he is sitting around me, so fresh & lively, smiling.. having a convo on Naats, Allama Iqbal, talking to me about Salah & deeniyaat. I couldn't write anything for a couple of weeks & had no words to express. Life is so unpredictable.

Salah can take you to jannah, definitely, he implemented it throughout his life and proved it with his demise. What a great way of passing by.. in a mosque, offering Salah.. any Sunni would wish for. While we all will be doing our part on the Judgement Day, he will get up from his grave in Sujood, offering prayer to Almighty Allah, InshaAllah.

These lines are written for proud Muslims like him.

Main Woh Sunni Hoon Jameel-e-Qadri Marne Ke Bad Mera Laasha Bhi Kahega, As-salat o Wassalam.

Commonly we use for others "Rest in Peace" but for him, I assure you, **he will be peacefully resting in Jannah.**

I request Zaheer Bha, all my sisters and whosoever reading this.. you can do whatever you like for fatehakhwani n Isale sawaab for him but please offer 2 raka'at nafl salaah, his beloved prayer, for his Isaal-e-sawaab. May Allah Subhanahu ta'ala, by the Vaseela of beloved Prophet Mohammad sallallahu alayhe wasallam, grant him the highest place in Jannah, Aameen.

CSC

HDFC BANK



BAJAJ Allianz

ICICI Lombard
Nibhaye Vaade



Muzakeer Raza Azhari
+91 - 70414 59591
visionconnect@yahoo.com

All Types of Digital eGovernance
Banking & Insurance Service's Provider
Tours & Travels Booking Center

VISION
CONNECT
ONE STOP POINT FOR ALL e-GOVERNANCE & DIGITAL SERVICE

Jetpur - 360 370, GUJ, IN

જુનેદ - મો. ૯૦૬૭૭ ૬૦૨૦૦

અબુભાઈ - મો. ૯૮૨૪૫ ૮૨૪૮૮

ફેમસ પાન & સોડા શોપ

અમારે ત્યાંથી દરેક જાતના ઠંડા પીણા મળશે.

જેલ રોડ, જુનાગઢ.

Abu Khatri

Mob. 88 66 72 72 88
98245 82488



SAFEKILL
Pest Services

Quality is Our Motto

Near Fast Track Court, Jail Road, Junagadh-362 001.

ફાઇલે ઝકાત

અઝ. મૌલાના મોહમ્મદ સિદ્દીક સાહેબ રઝવી - વાલાસણ, તા. વાંકાનેર

સાહીને શરીઅત સરાપા એ રહેમત સદ્દાહો ત્યાલા અલૈહિ વસદમને ઝરીએ અદાહ ત્યાલાને ઉમ્મતે મુસ્તુફા કો કાનૂને ઈસ્લામ સે રોશન ફરમાયા જુસ તરહ નમાઝ-રોઝા-હજ વગેરા ઉમ્મતે મુસ્લિમા પર ફર્ઝ ક્રિયા હૈ ઈસી તરહ ઝકાત ભી ફર્ઝ કી ગઈ હૈ - ઝકાત ઈસ્લામ કા એક અહેમ રૂકન હૈ, જિસકી તાકીદ કુરઆને મજુદ ઓર અહાદીસે મુસ્તુફા મે બાર બાર આઈ હૈ.

ઝકાત અદા કરને વાલો કે ફાઇલે કુરઆન ઓર અહાદીસે મુબારકા મે બેશુમાર વારીદ હૈ.

અદાહ ત્યાલા કે ફરમાને આલીશાન હૈ

- (૧) એ મહબુબ ! ઉંકે માલ સે ઝકાત વસુલ કરો જુસે તુમ ઉંહે સુથરા ઓર પાકીઝા કર દો - સૂરેહ તોબા
- (૨) ઓર વો લોગ જો ઝકાત દેને કા કામ કરતે હૈ - સૂરેહ મોમીનૂન
- (૩) વો લોગ ફલાહ પાતે હૈ-જો ઝકાત અદા કરતે હૈ
- (૪) હુઝૂર સરવરે કાઈનાત સદ્દાહો ત્યાલા અલૈહિ વસદમને ઈશ્લાહ ફરમાયા, ઈસ્લામ કા પૂરા હોના ચે હૈ કે અપને માલો કી ઝકાત અદા કરો. મુસ્તફા જાને રહેમતને ફરમાયા, ઝકાત દે કર અપને માલો કો મઝબૂત કિલ્ઓ મે મેહફુઝ કર લો - અબૂ દાઉદ
- (૫) હઝરતે અનસ બીન માલીક રદીઅદાહો ત્યાલા અન્હ સે રિવાયત હૈ, મુસ્તફા જાને રહેમતને ઈશ્લાહ ફરમાયા, અપને માલ કી ઝકાત નિકાલ કર પાક કર લો, વો તુજે પાક કર દેગા ઓર રિશ્તેદારો સે હુસ્ને સુલુક કરો ઓર મિસ્કીનો ઓર ફકીરો ઓર સાઈલ કા હક પેહચાનો - બહારે શરીઅત

ઝકાત ન અદા કરને વાલો પર વઈદે

અદાહ ત્યાલા ફરમાતા હૈ-વો જો બુખલ કરતે હૈ-ઝકાત નહીં દેતે હૈ-ઉસ યીઝ મે જો અદાહને ઉંહે અપને ફઝલ સે દી હૈ હરગીઝ ઉંસે અપને લીએ બેહતર ન સમજે બલ્કે વો ઉંકે લીએ બુરા હૈ. અનકરીબ વો જુસને ગુખલ કીયા થા કયામત કે દીન ઉંકે ગલે કા તોક હૈ (સૂરેહ ઈમરાન)

હઝરત ઉમર ફારૂકે આઝમ સે રિવાયત હૈ કે - સરવરે કાઈનાતને ઈશ્લાહ ફરમાયા જો કૌમ ઝકાત નહીં દેગી તો અદાહ ત્યાલા ઉંસે કહત સાલી મે મુબતલા ફરમાએગા. મુસ્તફા જાને રહેમતને ફરમાયા ખુશકી ઓર તરીમે જો માલ બરબાદ હોતા હૈ વો ઝકાત ન દેને સે હોતા હૈ.

હુઝૂર સદ્દાહો અલૈહિ વસદમને ફરમાયા, જહન્નમ મે સબસે પેહલે તીન શખ્સ જાએગે ઓર ઉંમે કા એક માલદાર હોગા જો અપને માલ કી ઝકાત ન દેતા હોગા.

હઝરત અબ્દુલાહ ઈબ્ને મસ્ઉદને ફરમાયા, નમાઝ પઢે ઓર ઝકાત દે ઓર જો ઝકાત નહીં દેતે હૈ ઉંસકી નમાઝ કબૂલ નહીં હોગી (બહારે શરીઅત).

ઝકાત તીન માલો પર હોતી હૈ : (૧) સોના-ચાંદી-પૈસા પર હોગી (૨) તિજારત કે માલ પર હોગી (૩) સાઈમા-જાનવર પર હોગી.

ઝકાત કીન લોગો પર વાજુબ હોતી હૈ વો ચે હૈ : (૧) મુસ્લમાન (૨) બાલીગ (૩) આકીલ (૪) આઝાદ (૫) નિસાબ (૬) એક સાલ કા હોના (૭) કર્ઝ કા ન હોના (૮)

નિસાબ કા હાજતે અસ્લીયા ફારીગ હોના (૯) માલ કા કમ ઓર ઝિયાદાહ હોના (૧૦) કમરી સાલ પૂરા હોના.

કિન લોગો કો ઝકાત દે સકતે હૈ : (૧) ફકીર (૨) મિસ્કીન (૩) આમીલ-ઝકાત વસૂલ કરને વાલા (૪) રિકાબ (૫) ગાઝીમ (૬) મુસાફીર (૭) કી સબીલિલાહ-તાલીબે ઈલ્મ વગેરા.


જદીદ મસાઈલે ઝકાત

- (૧) ફિક્સ ડિપોઝીટ-Fixed Deposit કરને વાલા આદમી અગર માલિકિ નિસાબ હૈ તો ઉંસકી ઝકાત રકમ પર વાજુબ હોગી વરના નહીં
- (૨) જીવન વિમા મે જમાસુદા રકમ કી ઝકાત હર સાલ વાજુબ હોતી રહેગી મગર જબ મીલ જાએગી તબ ઉંસકા અદા કરના વાજુબ હોગા ઓર ઝિયાદાહ રકમ-ઉપર કા પૈસા મિલને કે બાદ વો રકમ નિસાબ તર પહોંચ જાએ તો ઉંસ રકમ મે ઝકાત એક સાલ પૂરા હોને કે બાદ વાજુબ હોગી.
- (૩) મુલાઝીમીન કા પગાર મે સે જો ફંડ G.P.F. કે નામ પર જમા હોતા હૈ અગર વો મુલાઝીમીન માલિકિ નિસાબ હૈ ઓર દુસરી ઝકાત કે માલ સે G.P.F. કી રકમ જમા હોના સુરુઅ હુઈ હૈ, ઉંસ વકત સે ઉંસકી ઝકાત અદા કરના વાજુબ હોગી ઓર માલિકિ નિસાબ નહીં હૈ તો G.P.F. કી રકમ દુસરે માલ કે સાથ મિલાકર નિસાબ પૂરા હો જાતા હૈ ઓર વો હવાઈ જે અસ્લીયા સે બચ જાતા હૈ ઓર ઉંસ પર પૂરા સાલ હો જાતા હૈ, તો G.P.F. કી રકમ પર અબ ઝકાત વાજુબ હોગી ઓર અબ હર સાલ ઝકાત વાજુબ હોતી રહેગી.
- (૪) કિસી કંપની કે શેર-Shares આપને ખરીદા અબ વો શેર નિસાબ કી મિકદાર કે બરાબર હો ગયા તો ઝકાત દેના હોગા.
- (૫) તિજારત કે માલ પર ઝકાત, property મે મકાન-દુકાન-સામાન-પ્લોટ વગેરા કિરાએ પર દિયા હૈ તો કિરાયા કી રકમ પર ઝકાત દેના હોગા ઓર અસ્લ મકાન-દુકાન જિસમે રેહતા હૈ ઉંસ પર ઝકાત નહીં હૈ.
- (૬) વો રકમ જો આપને કિસી કો ઉધાર દિયા હૈ ઓર વો નિસાબ કે બરાબર હૈ તો ઉંસ પર ઝકાત દેના હોગા.
- (૭) તિજારત કા માલ કે ઓર ઉંસ પર એક સાલ પૂરા હો ગયા તો અબ ઉંસ માલ પર ઝકાત વાજુબ હોગી. માલ કી કિંમત પર વાજુબ હોગી ઓર નફાઅ પર નહીં હોગી (બહારે શરીઅત, ફતવાએ ફેઝુરરસુલ, ફતાવાએ ફકીહેમદત)

જદીદ મિકદારે નિસાબ સોના ઓર ચાંદી

(૧) સોના કા નિસાબ બીસ મિસ્કાલ-સાળે સાત તોલા સોના (૨) ચાંદી કા નિસાબ સાળે બાવન તોલા હૈ તો ૧૮૪ મીલીગ્રામ હોતા હૈ. સાળે બાવન તોલા ચાંદી કા ૬૫૩ ગ્રામ ઓર ચ્યારહા માસા કે સોને ચાંદી મે વઝન કા એતબાર હોગા કિંમત કા નહીં હૈ - એક તોલા વઝન બારાહ ગ્રામ ૪૪૧ મીલી ગ્રામ ઓર કુછ પોઈન્ટ હોતા હૈ. એક સો ચોરાસી ગ્રામ હૈ ઓર સોના તો સાળે સાત તોલા કા વઝન ૯૩ ગ્રામ ૩૧૨ મીલી ગ્રામ હોતા હૈ. ચે નચી તેહકીક મૂક્તી અખ્તર હુસેન અલીમી સાહેબ કે ફતવાએ અલીમીયા સે નકલ કી ગઈ હૈ.

(૨) આજકલ કુછ લોગ ઝકાત કી રકમ કો ચેક (Cheque) બનાકર દેતે હૈ તો ઉંસ સુરત મે તમલીક-ફકીર-કા પાયા જાના નહીં હુવા તો ઉંસ સુરત મે ઝકાત અદા નહીં હોગી. લેકીન ચેક કા માલીક હોના કોઈ જરૂરી નહીં કે ઈન્સાન માલ કા માલીક હો ગયા. ચેક એક માલીકી સનદ કે અલ હાસિલ ચેક સે ઝકાત ઉંસકે મૂસ્તદી કિનકો મીલ જાએ તબ ઝકાત અદા હો જાએગી વરના નહીં હોગી (ફતાવા એ અલીમીયા, જુલ્દ-૧)



NEW
RAJ
PLASTIC

Samir R.
Mob. 92272 13606

Mfg.: All type of Plastic Items and Gas Lighter Parts

3-GOKULNAGAR, RAJKOT - 360 002.



Mob. 88668 38281
88667 37270

Shop No. 1, Nagar Boarding,
Opp. Virani School,
Tagore Marg, Rajkot-360002.
E-mail: sarfaraz_8725@yahoo.com



7 Steps to Improve Your Eyesight How to Improve your Screen-tired-Eyes



Author's Note

I noticed a friend who never wore glasses started using them for reading. Having faced a similar situation, I shared my experience, expressing my dislike for wearing glasses. Instead, I delved into eye exercises, paid attention to my diet, incorporated supplements, and made lifestyle adjustments. I'm happy to share that I successfully eliminated the need for glasses.

In this article, I share my research and experiences to help you enhance your eyesight. This excerpt is from my book, "7 Steps to Reboot Your Well-Being" (details below). Various treatment modalities are explored for different steps, including Ayurveda, Yoga, Acupressure, and, of course, conventional medicine.

This article aims to transform you in two ways:

1. By making you aware of the risks associated with poor eyesight and offering remedies.
2. By guiding you through implementing steps that can set you on the path to recovery.

My writing journey is continually evolving over an extended period, mirroring my heuristic learning. I value your feedback and assure you of a response. If you provide your thoughts, I'll gladly send you my book on Sprouting and making your Food Alive.

Email me at max@healthyaging.foundation.

Introduction

"Our Body is preparing to die, as soon as we are born, but aging is not the sole cause of any diseases"
Max Haroon

Our body is like a machine, but an intelligent machine, it builds itself, from birth to adulthood and then starts declining like a machine. Stress and modern living exacerbate the declining process.

Eye diseases like myopia, cataract and macular degeneration are not the sole cause of aging, but combinations of genes, lifestyle and the environment.

More than ever, we are using our eyes to stare at small fonts (and images) on computer screens, televisions, and cell phones - which lead to eye fatigue and an increase in age-related eye problems. There is no sign that this situation will improve.

Consider these statistics published by W.H.O

A large number of the world population has some form of vision impairment. According to the US Vision Research Council, more than 59% of digital device owners in America have experienced symptoms of digital eye strain.

Approximately 80% of all vision impairment globally is considered avoidable.

જૂના અને જાણીતા

માહિત્ર - મો. ૯૯૦૪૧ ૨૦૧૨૫
ફોન : ૦૨૮૫-૨૬૨૩૩૩૮

ખત્રી યાકુબ ઈશાક યરમાવાલા

અમારે ત્યાંથી બ્રાન્ડેડ કંપનીના કાચ-ફેમ તથા ગોગલ્સ, લેન્સ ખૂબ જ વ્યાજબી ભાવે મળશે.
સર્કલ ચોક, જૂનાગઢ.

Since 1945





HALAI MUSLIM KHATRI TRUST

(Trust Regd. No. B/114-RAJKOT)

3-Gokulnagar, B/h. 50 ft. Road, Kothariya Main Road, RAJKOT-360 002. INDIA

Halai Muslim Khatri Trust has emerged with a thought to lift up the education level in our Khatri community and to help financially deserving students. A group is formed by well known social workers and prestigious members of our community in leadership of Dr. Aziz Khatri (Mumbai).

A good amount of fund is required to help our community children who could not continue their education further due to lack finance. Help us to this noble cause by donating as much you can.

We do accept Lillah, Sadaqah and Zakat.

Financial help to deserving students for university fee, uniform and stationary expenses.

Motivational seminars, Personality development & Career counseling

Donation Appeal

Create awareness of importance of education by monthly news paper 'Times of Khatri'

More importance on female education

More information and Inquiry :

President: Dr. Aziz Khatri (+91-9322403733)

Vice President: Rafik Chhatbar (+91-9427252547)

Secretary: Sameer Ghumra (+91-9227213606)

Bank Details:

ICICI Bank Ltd A/c No: 084805000923

IFSC Code: ICIC0000848

(domestic transactions)

ખત્રી બિરાદરો જોગ...

કોઈપણ સમાજને શિક્ષિત, ચેતનવંતો, કુરિવાજવિહીન બનાવવા માટે જો કોઈ મુખ્ય સ્ત્રોત પૈકી હોય તો તે સમાજનું મુખપત્ર છે. જેના થકી સમાજમાં પ્રવર્તી રહેલા પ્રવાહોને વાચા આપવામાં આવે છે, પોતાના વિચારોને સમગ્ર સમાજ સામે રજૂ કરી શકાય છે, સમાજના દૂષણો પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે, તેને ડામવાના વિચારો રજૂ કરવામાં આવે છે. આવી તમામ જવાબદારીઓ 'ટાઇમ્સ ઓફ ખત્રી' બખૂબી બજાવી રહ્યું છે અને તેનો ફાયદો પણ આપ લોકોની સમક્ષ દેખાઈ રહ્યો છે. સમાજ આજે જાણે તંદ્રામાંથી જાગીને, ઉત્સાહિત થઈને સમાજહીતના કામે લાગી ગયો છે. તેવા સમયે આપણી પણ ફરજ બની રહે છે કે આપણું આ મુખપત્ર આજના મોંઘવારીના

સમયમાં ટકી રહે, વર્ષો સુધી સમાજની સેવામાં સેતુરૂપ કાર્ય કરતું રહે, એ માટે આપનું લવાજમ તાત્કાલિક ઓફિસ કાર્યાલયે મોકલી આપવું. આપની આ લવાજમરૂપી સહાયથી જ આપણું 'ટાઇમ્સ ઓફ ખત્રી' ટકી રહેશે.

આપ સર્વેને વિનંતી કરવામાં આવે છે કે આપે આપનું લવાજમ તાત્કાલિક કાર્યાલયે મોકલી આપવું અને સમાજમાં દરેકે દરેક ઘર નિયમિત લવાજમ પહોંચાડે તેવા પ્રયત્નો કરવા.

આપના સારા-નરસા પ્રસંગોએ આપણાં સમાજના મુખપત્રને યાદ રાખી સમાચારની વિગતો ઇમેઇલ ચોકકસ કરશો. આપણાં મુખપત્રને આવા સમયે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશો તેવી અપીલ છે.



Dr. A. G. DHADA

M.S. (Ortho)

Consulting Orthopaedic
& Hand Surgeon

Dhada Hospital

Fracture, Accident, Orthopaedic & Surgical Hospital,
Address: Near Raj Talkies, Tembhode Road, Palghar 401 404.
Timing: 10:00 am to 1:00 pm Tel.: 02525 254229 / 251472

City General Hospital

General & Industrial Trauma Centre
Address: Near SBI, Khodaram Baug, Tarapur Road,
Boisar, Dist. Thane, Timing: 4:00 pm to 7:00 pm
Tel.: 02525 267181 Mobile: +91 98231 82340



SHAMIYANA DYEING

MANUFACTURERS & PRINTERS OF ALL TEXTILE PRODUCTS

JETPUR-NAVAGADH, GUJARAT (INDIA) - 360 370.

Tel.: +91-2823-224345, Fax: +91-2823-220982, E-mail: shamiyanadyaing@gmail.com

MUSTAK - +91 9879909192

KADAR - +91 98792 79296

If undelivered please return to:

ટાઈમ્સ ઓફ ખત્રી
Times of Khatri**Halai Muslim Khatri Trust**Gokulnagar, Street No. 3, B/h. 50 Feet Road,
Kothariya Main Road, RAJKOT-2. Mob. 94272 52547

To,

Posting Dt. 7th of every month at Rajkot RMS

સમાચાર ધર્મણ**સગપણ**

રાજકોટના રહીશ જનાબ ઇસ્કાન (ઇલુ) ઇશાકભાઈ ટાટારીયાના નેક ફરઝંદ તન્વીર નું સગપણ મીઠું મોઢું ગોંડલના રહીશ જનાબ રિયાઝ મુસ્તફા મમતોરા (બાબુભાઈ)ની નેક દુખ્તર અકસાબાનુ સાથે તા. ૦૪-૦૨-૨૦૨૪ના રોજ ગોંડલ મુકામે થયેલ છે. આ ખુશીના પ્રસંગે રાજકોટ જમાતને ઇસ્કાન ઇશાકભાઈ ટાટારીયા તરફથી રૂ. ૧૦૦, તેસીમ ઇશાકભાઈ ટાટારીયા તરફથી રૂ. ૧૦૦, રફીક મજીદભાઈ ટાટારીયા તરફથી રૂ. ૧૦૦ બક્ષિસ મળેલ છે. શુક્રિયાહ સહ મુબારકબાદ.

FORM IV

Statement about ownership and other particulars about newspaper (TIMES OF KHATRI) to be published in the first issue every year after the last day of February

- Place of publication : HALAI MUSLIM KHATRI TRUST, RAJKOT
at GOKULNAGAR, STREET NO. 3, B/H. 50 FEET ROAD,
KHOTHARIYA MAIN ROAD, RAJKOT. Gujarat.
- Periodicity of its publication : MONTHLY
- Printer's Name : NAZIR V. SHERASIYA
Nationality : INDIAN
Address : STAR COMPUER, 101-C POOJA COMPLEX, NR.G.P.O.,
RAJKOT-360 001. (Guj)
- Publisher's Name : SAMIR R. GHUMARA
(On behalf of HALAI MUSLIM KHATRI TRUST)
Nationality : INDIAN
Address : GOKULNAGAR, STREET NO. 3, B/H. 50 FEET ROAD,
KHOTHARIYA MAIN ROAD, RAJKOT.
- Editor's Name : RAFIK ABUBAKAR CHHATBAR
Nationality : INDIAN
Address : 1-MANHARA PARA, STREET NO. 1, B/H. BEDIPARA FIRE
STATION, BHAVNAGAR MAIN ROAD, RAJKOT.
- Names and addresses of individuals who own the newspaper and partners or shareholders holding More than one percent of the total capital.

HALAI MUSLIM KHATRI TRUST, RAJKOT at GOKULNAGAR, STREET NO. 3, B/H. 50 FEET ROAD, KHOTHARIYA MAIN ROAD, RAJKOT

I, RAFIK ABUBAKAR CHHATBAR, hereby declare that the particulars given above are true to the best of my knowledge and belief.

Date : 01/03/2024

HALAI MUSLIM KHATRI TRUST, RAJKOT, Publisher

મલ્ટીકલર ઓફસેટ મુદ્રિત “ટાઈમ્સ ઓફ ખત્રી”ને સજીવન રાખવા આપના દરેક સુખ,
દુઃખના પ્રસંગે ‘ટાઈમ્સ ઓફ ખત્રી’ને હંમેશા યાદ રાખો અને
આપનું ડોનેશન તુરંત મોકલશો..

સમાચાર-લેખન-કૃતિઓ મોકલવા માટે: **E-mail: timesofkhatri@gmail.com**